

# KANUNGO FINANCIERS LIMITED

CIN:- L65100GJ1982PLC086450

---

Date: 16.02.2022

To  
The Department of Corporate Affairs,  
Bombay Stock Exchange Limited,  
P J Towers, Dalal Street  
Mumbai

**SUB: SUBMISSION OF PAPER ADVERTISEMENT OF FINANCIAL RESULTS AS  
ON 31.12.2021 AS PER REGULATION 47**

**Ref.: BSE Script code:-540515**

Dear Sir,


With respect to captioned subject, the company hereby informed you that the company has published the copy of an extract of Unaudited Financial Results for the quarter ended on 31<sup>ST</sup> December, 2021 in the Newspaper as per regulation 47 of SEBI (LODR), 2015. And the copy of the Newspaper Advertisement is attached herewith.

Kindly acknowledge the same & take on your records.

Thanking You.

Yours Faithfully

**For, KANUNGO FINANCIERS LIMITED**



**DIRECTOR  
CHIRAG KIRTIKUMAR SHAH  
DIN: 08111288**



## Crime, climate and convergence: BSI launches new global intelligence report on supply chains for the year ahead

New Delhi, BSI, the business improvement and standards company and leading global provider of supply chain intelligence, unveiled its annual Supply Chain Risk Insights Report – the new report lands at a time when supply chains are dominating discussion both in boardrooms and households.

The report identifies the trends and associated risks impacting global supply chains in 2022 and highlights five key themes to enable organizations to achieve resilience:

- Supplier transparency as a key decider of business success
- A shifting Environmental, Social and Governance (ESG) regulatory environment
- A holistic understanding of 'pain points'
- Adapting to 'convergences' of business challenges
- Identifying opportunities in emerging trends

able organizations to achieve resilience:

- Supplier transparency as a key decider of business success
- A shifting Environmental, Social and Governance (ESG) regulatory environment
- A holistic understanding of 'pain points'
- Adapting to 'convergences' of business challenges
- Identifying opportunities in emerging trends

Screen, provides valuable insight into the significance of these threats while offering analysis and practical guidance to organizations on best practices to mitigate and counter risks. Susan Taylor Martin, Chief Executive, said: "The past few years have put a spotlight on global supply chains and reinforced their crucial role in our day-to-day life. Because of this unprecedented moment, the supply chain is about to have a make-or-buy year and needs to be right at the top of the C-suite agenda. Jim Yarbrough, BSI's Global Intelligence Program Manager, added, "As we continue to manage a multitude of challenges, including COVID, climate change and natural disasters, we have seen the convergence of impacts on organizations and the global community, illustrating the

Screen, provides valuable insight into the significance of these threats while offering analysis and practical guidance to organizations on best practices to mitigate and counter risks. Susan Taylor Martin, Chief Executive, said: "The past few years have put a spotlight on global supply chains and reinforced their crucial role in our day-to-day life. Because of this unprecedented moment, the supply chain is about to have a make-or-buy year and needs to be right at the top of the C-suite agenda. Jim Yarbrough, BSI's Global Intelligence Program Manager, added, "As we continue to manage a multitude of challenges, including COVID, climate change and natural disasters, we have seen the convergence of impacts on organizations and the global community, illustrating the

broad-brush consequences of disruptions and threats to our supply chains and the importance of not underestimating their complexities. Pankaj Srivastava – Whole Time Director – BSI India said "As supply chain issues persist in 2022, it is imperative that organizations build in the necessary resilience to cope with these disruptions. The ability to work around supply chain disruption, and thrive in the face of it, will become a key differentiator in 2022 and businesses should not shrink from seeking advice in this area when needed.

## Swiggy set to acquire Dine Out for around \$200 mn

New Delhi, Feb 14 (IANS) Leading online food delivery platform Swiggy is set to acquire Times Internet-backed dining out platform Dineout for close to \$200 million, reliable sources said here on Monday. Dineout was also in talks with leading fintech platform Cred but Swiggy has apparently won the race. Sources told IANS that Swiggy-DineOut talks are now in the final stage for an acquisition that will be in the range of \$200 million (at the current valuation of Dineout). Swiggy and Dineout did not immediately comment on the development. Swiggy's closest rival Zomato is already in the dining out business. Dineout was founded by Ankit Mehrotra, Nikhil Bakshi, Sahil Jain, and Vivek Kapoor in 2012. Times Internet in 2014 acquired the dining out platform for an estimated Rs 60 crore. The last two years of the pandemic severely hit the dining out industry in the country and Dineout business was also affected. According to the National Restaurant Association of India (NRAI), in FY21, the Indian food services industry contracted severely leading to permanent closure of over 25 per cent of food business operators which resulted in job losses of nearly 24 lakh people.

## Business Brief

### Adani Ent. attributable consolidated Q3FY22 net loss at Rs 12 cr

New Delhi, Feb 15 (IANS) Adani Groups subsidiary Adani Enterprises on Monday reported an attributable consolidated net loss of Rs 12 crore due to losses in developing business.

The company had posted a net profit of Rs 297 crore in Q3FY21. The company's total income increased to Rs 18,963 crore due to improved realisation on the back of higher index prices in the IRM segment.

During the same quarter in the previous fiscal, the total income was Rs 11,787 crore. eased by 4 per cent to Rs 977 crore. "Our strategy of AEL remaining India's fastest multi-industry incubator remains unchanged," said Gautam Adani, the Chairman of Adani Group.

### EV maker Okinawa Autotech opens 2nd manu. plant in India

New Delhi, Feb 15 (IANS) Electric two-wheeler manufacturer Okinawa Autotech on Tuesday said it has commenced operations at its second manufacturing unit located in Bhiwadi, Rajasthan.

The company aims to manufacture close to three lakh electric vehicles per year at the new plant, which will eventually be increased to a capacity of 1 million in the next two-three years -- over five times the capacity of its current plant located in Alwar. The new manufacturing facility will also employ over 250 people. "The market is evolving at a fast pace, and the ramped-up capacity will undoubtedly aid us in bolstering the mass transition to e-mobility with a diverse and innovative product portfolio," said Jeetender Sharma, MD and Founder of Okinawa Autotech.

### Equities marginally up in early trade; Hero Motocorp top mover

New Delhi, Feb 15 (IANS) India's key indices - S&P BSE Sensex and NSE Nifty50 -- rose marginally in early trade on Tuesday due to value buying after a sharp plunge during the previous session.

A global sell-off on the back of heightened tensions between Russia and Ukraine heavily dented equities on Monday.

At 10.41 a.m. on Tuesday, Sensex traded at 56,544.70 points, up 0.3 per cent or 139 points, whereas Nifty traded 16,888.6 points, up 0.3 per cent or 46 points. Among the stocks, Hero Motocorp, Eicher Motors, Shree Cement, Nestle India, and Hindustan Unilever were the top five gainers. Cipla, Tata Steel, Indusind Bank, JSW Steel, and Grasim Industries, on the other hand, were the top losers in the morning session.

### Vedanta, Foxconn join hands to manu. semiconductors in India

Mumbai, Feb 15 (IANS) Mining major Vedanta and Hon Hai Technology Group, better known as Foxconn, which is the world's largest electronics manufacturing company, have collaborated to manufacture semiconductors in India, as the government opens the PLI (performance-linked incentive) scheme to locally manufacture chips in the country.

This first-of-its-kind joint venture between the two companies will support Prime Minister Narendra Modi's vision to create an ecosystem for semiconductor manufacturing in the country, the companies said in a statement. According to the MoU, Vedanta will hold the majority of the equity in the JV, while Foxconn will be the mity shareholder. Vedanta Chairman Anil Agarwal will be the Chairman of the joint venture company.

**CHANGE OF NAME**  
I have changed my old name from KHAN AISHA MOHAMMED UZAIR to new name PATHAN AISHA MOHAMMED UZAIRKHAN. Add: 502, Faizan Appt, Paldi, Ahmedabad. 3862

**CHANGE OF NAME**  
I have changed my old name from KHAN MOHAMMEDUZAIR FARIDKHAN to new name PATHAN MOHAMMEDUZAIRKHAN FARIDKHAN. Add: 502, Faizan Appt, Paldi, Ahmedabad. 3862A

**CHANGE OF NAME**  
I have changed my old name from POOJA HARSHILKUMAR PATEL to new name POOJA HARSHIL PATEL. Add: 24/B, Nirant Park House, Owners Association, Opp. Sun N Step Club, Thaltej, Ahmedabad. 3861

**Disposal of Approx. 70.90 MT of MS Scrap of Plant and Machinery, Storage Tanks, Chimney, etc.**  
E-Auction Forms are invited for Disposal of salvage of Approx. 70.90 MT Fire Affected remnants of MS Scrap of Plant and Machinery, Storage Tanks, Chimney, etc. to be sold on Per MT and on 'As Is Where Basis' lying at M/s BEC Fertilizers Ltd., GIDC, Jhagadia, Bharuch, Gujarat. Inspection can be done on 17/02/2022 to 20/02/2022 with prior appointment. Date of e-auction is 24/02/2022 from 3.00 PM onwards till 04.00 PM. E-Auction Form with Earnest Money Deposit (EMD) to be submitted latest by 23/02/2022 up to 06.00 PM at E-auctioneer's below mentioned address. E-Auction Portal is www.optimumeauction.com, visit and register yourself. Tender form specifying terms & conditions for visit and e-auction can be collected in person and/or online from the details given below: For Inquiries Please Contact:- Laxmi Sharma (Optimum): 99599727452, Tel: 0129-4159255, Mr. Sanjeev Yadav (M/s BEC Fertilizers): 7876150159. Email: support@optimumeauction.com Optimum Realiser E-Auctioner Pvt Ltd, 122, 1st Floor, SRS Tower, Near Mevala Maharajpur Metro Station, Sec-31, Faridabad-121001

**Western Railway- Bhavnagar Division PUBLIC NOTIFICATION**  
It is notified for the information of the general public that Commissioner of Railway Safety (Western circle) Mumbai will be inspecting newly constructed Broad Gauge line between Sabarmati D cabin and Lothal Bhurkhi stations of Sabarmati D cabin - Botad Gauge conversion project on 15.02.2022 and 16.02.2022. During the inspection, speed trial will be conducted by a Special train at a speed of more than 100 KMPH on new BG line between Sabarmati D cabin, Gandhigram, Sarkhej, Moraiya, Matoda, Bavla, Dholka, Godhreshwar, Koth Gangad and Lothal Bhurkhi stations on 16.02.2022. Accordingly, General public is hereby informed to keep away from Railway track for their own safety. Chief Project Manager Rail Vikas Nigam Limited, Ahmedabad

**ROBERT RESOURCES LIMITED**  
CIN: L99999GJ1982PLC096012  
REGD. OFF: - 3rd FLOOR, PLOT NO 1067, OPP. BINDU NIVAS, KALIYABID ROAD BHAVNAGAR-364001, GUJARAT, Contact No: +91-9067584982  
Email: robertresourceslimited@gmail.com Website: www.robertresources.com  
Extract of Unaudited Financial Results for the Quarter and Nine month ended on December 31, 2021 (Rs. in Lakhs)

S. No.	Particular	Quarter ended			Nine Month ended		Year Ended (Audited)
		31-12-2021 (Unaudited)	30-09-2021 (Unaudited)	31-12-2020 (Unaudited)	31-12-2021 (Unaudited)	31-12-2020 (Unaudited)	
1.	Total income from operations (net)	228.22	43.00	17.63	271.49	67.51	137.27
2.	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary	200.73	100.62	15.08	215.79	23.27	97.99
3.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary	200.73	100.62	15.08	215.79	23.27	97.99
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	140.78	98.36	11.28	147.18	17.41	75.35
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	101.86	99.83	27.37	172.42	60.21	64.13
6.	Equity Share Capital	1024.50	1024.50	1024.50	1024.50	1024.50	1024.50
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year						221.71
8.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -						
	1. Basic:	1.37	0.96	0.11	1.44	0.17	0.74
	2. Diluted:	1.37	0.96	0.11	1.44	0.17	0.74

Notes: 1. The aforesaid results of the Company were reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 14th February, 2022. The statutory auditors of the Company have carried out a Limited Review of the aforesaid results. 2. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange www.mse.in and on company's website www.robertresources.com. 3. The Previous year/period figures have been regrouped/rearranged, wherever necessary to make them comparable with the current period figures.

Place: Bhavnagar. Date: 14/02/2022

For, Robert Resources Limited  
Sd/- Hanif Shekh Managing Director DIN: 07497812

**SHIVANSH FINSERVE LIMITED**  
CIN:L65100GJ1984PLC082579  
Regd. & Corporate Office:- 22 First Floor, Harsidh Complex, Opp Kalupur Commercial Bank, Income Tax, Ashram Road, Ahmedabad - 380009. Contact No:- 7927540337, Email on:- shivanshfinserve@gmail.com, website:- www.shivanshfinserve.com

**ANNEXURE I**  
EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2021 (Rs. in lakhs except EPS)

PARTICULARS	Quarter ending (31/12/2021)	Quarter ending (30/09/2021)	Quarter ending (31/12/2020)	Nine Months ended Figures (31/12/2021)	Year to date Figures (31/03/2021)
	1 Income from operations	4.26	128.96	16.77	133.22
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	(6.93)	31.03	(9.91)	19.02	11.07
3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	(6.93)	31.03	(9.91)	19.02	11.07
4 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	(5.19)	24.40	(9.73)	11.80	7.98
5 Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(5.19)	24.40	(9.73)	11.80	7.98
6 Equity Share Capital	624.00	624.00	624.00	624.00	624.00
7 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	17.62
8 Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -					
Basic	(0.08)	0.39	(0.16)	0.19	0.13
Diluted	(0.08)	0.39	(0.16)	0.19	0.13

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Bombay Stock Exchange and the listed entity www.shivanshfinserve.com. 2. The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote. 3.# - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.

Place: Ahmedabad Date: 10-02-2022

For and on behalf of Board of Directors  
SHIVANSH FINSERVE LIMITED  
Sd/- JIGNESH SUDHIRBHAI SHAH "DIRECTOR" DIN: 02112343

**PURPLE ENTERTAINMENTS LIMITED**  
CIN:L65100GJ1974PLC084389  
Regd. Office:- 30-B, 3rd floor, Ajanta complex, Income Tax, Ashram Road, Ahmedabad - 380009. Email on:- purpleentertainments7@gmail.com website:- www.purpleentertainment.co.in

**ANNEXURE I**  
EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2021 (Rs. in lakhs except EPS)

PARTICULARS	Quarter ending (31/12/2021)	Quarter ending (30/09/2021)	Quarter ending (30/12/2020)	Nine Months ended Figures (31/12/2021)	Year to date Figures (31/03/2021)
	1 Income from operations	-	-	-	-
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	18.66	7.85	16.94	36.41	33.25
3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	18.66	7.85	16.94	36.41	33.25
4 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	13.43	6.76	17.06	27.56	24.66
5 Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	13.42	9.27	17.06	30.06	24.66
6 Equity Share Capital	864.60	864.60	864.60	864.60	864.60
7 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	22.21
8 Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -					
Basic	0.16	0.08	0.20	0.32	0.29
Diluted	0.16	0.08	0.20	0.32	0.29

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Bombay Stock Exchange and the listed entity www.purpleentertainment.co.in. 2. The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote. 3.# - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.

Place: Ahmedabad Date: 14-02-2022

For and on behalf of Board of Directors  
Purple Entertainment Limited  
Sd/- MANJULABEN KOTHARI DIRECTOR DIN: 08012476

**KANUNGO FINANCIERS LIMITED**  
CIN:- L65100GJ1982PLC086450  
REGD. OFFICE: - B-7, B wing, 5th Floor Ajanta Commercial Center, Income Tax, Ahmedabad - 380009, (O) 079-48002688, Mail at: - kanungofinanciers@gmail.com, website:- www.kanungofinanciers.com

**ANNEXURE I**  
EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2021 (Rs. in lakhs except EPS)

PARTICULARS	Quarter ending (31/12/2021)	Quarter ending (30/09/2021)	Quarter ending (31/12/2020)	Nine Months ended Figures (31/12/2021)	Year to date Figures (31/03/2021)
	1 Income from operations	-	-	-	-
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	(8.79)	(154.22)	113.42	(354.26)	(14.44)
3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	(8.79)	(154.22)	113.42	(354.26)	(14.44)
4 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	(3.81)	(155.87)	109.17	(354.78)	(29.67)
5 Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	52.68	147.99	162.15	29.18	52.20
6 Equity Share Capital	463.40	463.40	463.40	463.40	463.40
7 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	35.54
8 Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -					
Basic	(0.08)	(3.36)	2.36	(7.66)	(0.64)
Diluted	(0.08)	(3.36)	2.36	(7.66)	(0.64)

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Bombay Stock Exchange and the listed entity www.kanungofinanciers.com. 2. The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote. 3.# - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.

Place: Ahmedabad Date: 14-02-2022

For and on behalf of Board of Directors  
KANUNGO FINANCIERS LIMITED  
Sd/- CHIRAG K. SHAH "DIRECTOR" DIN: 08111288

**TIRUPATI SARJAN LTD.**  
CIN:L45100GJ1995PLC024091  
Registered Office: A/11, 12, 13, Satyamev Complex, Opposite Gujarat High court, S.G. Highway, Ahmedabad 380060 M : 91-79-2766 2013. Web: http://www.tirupatisarjan.com Email id: cs.tirupatisarjan@gmail.com

Statement of Standalone Unaudited Financial Results for the third quarter and nine months ended 31st December, 2021 (in lacs)

SR. NO.	PARTICULARS	Quarter ended 31/12/2021	Nine Month Ended 31/12/2021	Quarter ended 31/12/2020
1	Total Income from Operations	2047.40	5629.01	1387.31
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	37.27	75.90	41.29
3	Net Profit / (Loss) for the period before tax (after Extraordinary and/Extraordinary items)	37.27	75.90	41.29
4	Net Profit / (Loss) for the period after tax(after Extraordinary and/or Extraordinary items#)	37.27	54.19	29.48
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	37.27	54.19	29.48
6	Equity Share Capital (FV Rs. 5/ each)	1649.91	1649.91	1649.91
7	Other equity	-	-	-
8	Earning per share (Face value Rs. 5/- each) (for continuing and discontinued operations)			
	(a) Basic	0.11	0.16	0.09
	(b) Diluted	0.18	0.38	0.14

Notes: a) The above is an extract of the detailed format of quarterly/nine months Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly/nine months Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. b) The above results were approved by Audit Committee in its meeting held on 14th February, 2022 and subsequently taken on record by the Board of Directors at its meeting held on 14th February, 2022.

For, Tirupati Sarjan Limited  
Sd/- Ruchir Rushikeshbhai Patel Director DIN : 03185133

Date : 14/02/2022 Place : Ahmedabad

**CHANGE OF NAME**  
I have changed my old name from KAILASHBHAI KISHORBHAI KANOJIA to new name KAILASH KISHORBHAI KANOJIA. Add: H/10, Camp Sadar Bazar, Ahmedabad.-380001 3859

**CHANGE OF NAME**  
I have changed my old name from SABBIR FAKIRBHAI RUBYWALA to new name SHABBI FAKRUDIN RUBYWALA. Add: A-13, Lala Complex, Shahealam, Ahmedabad. 3860

**Gujarat Urban Development Company Limited**  
(Govt. of Gujarat Undertaking)  
Karmayogi Bhavan, Block No.1, B1 Wing, Ground Floor, Sector-10/A, Gandhinagar, Telefax : 079-23246126, 27,28  
CIN:U75140GJ1995SGC036051  
Email:contact@gudctd.com Website : www.gudctd.com

**E-Tendering Notice**  
Ref.No.GUDC/AMRUT/SEW/31

Gujarat Urban Development Company Ltd. invites online tenders by e-tendering for Kalol SEW under AMRUT: Rs.40.12 Lacs EPC basis. Tenders will be uploaded from 17/02/2022 on the website https://gudc.nprocure.com. All subsequent information, notification, changes and amendments will be posted only on the aforesaid website. INF/3155/21-22

**Gujarat CSR Authority**  
3rd Floor, GSFC Building, Opp Drive In Cinema, B/11 Relief Mart, Bodakdev, Ahmedabad, Gujarat-380 054

**Inviting Agency for the Construction work of Panchayat Bhavan at Lakhigam Village**  
GCSRA intends to engage contractor for the construction work of Panchayat Bhavan at Lakhigam Village For this purpose, Bid are invited in the manner prescribed in the Tender Document. The detailed Tender is available on website www.nprocure.com. The last date of submission of the Tender is mentioned in advertisement on nprocure (www.nprocure.com) in case of any changes in tender conditions GCSRA will update on its website i.e. www.gcsra.org. COO,GCSRA INF/ABD/1681/2022

**GUJARAT MARITIME BOARD**  
ONLINE TENDER NOTICE FOR

1. Electrical infrastructural work for development of Fishery harbour phase-III at Mangrol (Est. Cost Rs.02,73,10,160)

**Tender Notice No.XEN(M)2021-22/13**  
On behalf of Chairman, Gujarat Maritime Board, the Executive Engineer (Mech), Bhavnagar (Tel:0278-2443195) invites online tender offer through www.nprocure.com from experienced agencies for above mentioned work.

Bid document downloading and online submission end date is 04/03/2022 upto 18.00 hrs. and physical submission of Tender fee/EMD & other document through RPAD/Speed post only as per detailed NIT is 05/03/2022 to 14/03/2022 up to 18.00 hrs. Detailed terms & conditions and other related information is given in the online Bid document. For more details please visit GMB website www.gmbports.org and www.nprocure.com or contact Executive Engineer (Mech), Bhavnagar. DDI/BVN/906/21-22



કોરોના નવા કેસમાં ઘટાડો, મૃત્યુઆંક પણ ઘટ્યો

ભારતમાં કોરોના એન્ડેમિક તબક્કામાં પહોંચવાના સંકેત

(એજન્સી) નવી દિલ્લી, ભારતમાં સતત કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો છે. સંક્રમણ દર પણ નીચા સ્તરે રહે છે. એવામાં જાણીતા વાઈરોલોજિસ્ટ ડી જેકબ જોને કહ્યું છે કે જો ભારતમાં કોવિડ-૧૯ ના દૈનિક કેસોની સંખ્યા ૪ અઠવાડિયા સુધી ઓછી અને સ્થિર રહે તો જ તે માની શકાય કે કોરોના વાયરસ સંક્રમણ 'એન્ડેમિક' છે (સ્થાનિક સ્તર પર ફેલાવારી બિમારી) ના તબક્કામાં પ્રવેશી રહ્યાં છે. જોને કહ્યું કે જ્યારે સમુદાયમાં કેસોની સંખ્યા એક ગ્રાફ પર બતાવવામાં આવે છે, ત્યારે કેસોની સંખ્યામાં વધારો, ટોચ પર પહોંચવાની અને ઘટવાની સિસ્ટમને મહામારી (એપિડેમિક) કહેવામાં આવે છે અને કેસોની સંખ્યાની આડી અને સ્થિર સ્થિતિને એન્ડેમિક કહેવામાં આવે છે. જ્યારે મહામારીની સિસ્ટમ ફરીથી રચાય છે, ત્યારે તેને લહેર કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે એટલા માટે જ્યાં

વાઈરોલોજિસ્ટ ડી જેકબ જોને કહ્યું કે જો ભારતમાં કોવિડના દૈનિક કેસોની સંખ્યા ૪ અઠવાડિયા સુધી ઓછી અને સ્થિર રહે તો એન્ડેમિક કહી શકાય

સુધી કેસોની સંખ્યા ૪ અઠવાડિયા સુધી થોડી વધવટ સાથે ઓછી અને સ્થિર રહે ત્યાં સુધી, અમે તેને સ્થાનિક તરીકે જાહેર કરી શકીએ નહીં. જોને કહ્યું કે ઓમિકોન લહેર ઝડપથી નબળું પડી રહી છે અને થોડા દિવસોમાં અમે ઓછામાં ઓછા કેસ નોંધી શકીએ છીએ, પરંતુ અમે એન્ડેમિક તબક્કા વિશે ખાતરી કરી શકીએ તે પહેલાં આપણે ૪ અઠવાડિયા રાહ જોવી પડશે. જોને કહ્યું કે જેમ ઓમિકોન આપણને પ્રવેશી રહ્યું છે તે નહીં, સામાન્ય જાનતાના દૈનિકોણથી તેની સુસંગતતા મર્યાદિત છે. લહેરિયાએ કહ્યું કે લોકોએ જોખમના સ્તરના આધારે વાયરસ સાથે જીવવાની નવી રીતો સાથે પોતાને અનુકૂળ બનાવવું પડશે. કોવિડ-૧૯ને કારણે ડિરેક્ટરે કહ્યું કે તેની આગાહી કરી

શકાતી નથી, પરંતુ માત્ર અંદાજ લગાવી શકાય છે. તેમણે આગાહી કરી હતી કે સ્થાનિક તબક્કા ઘણા મહિનાઓ સુધી ચાલશે અને ઓમિકોન કરતાં વધુ ચેપી અને ડેલ્ટા કરતાં વધુ ખતરનાક કોઈ બીજું સ્વરૂપ સામે આવશે. મહામારી વિશેષજ્ઞ અને દિલ્લી સ્થિત ફાઉન્ડેશન ફોર પીપલ-સેન્ટ્રિક હેલ્થ સિસ્ટમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચંદ્રકાંત લહેરિયાએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ ભારતમાં સ્થાનિક તબક્કામાં પ્રવેશી રહ્યું છે તે નહીં, સામાન્ય જાનતાના દૈનિકોણથી તેની સુસંગતતા મર્યાદિત છે. લહેરિયાએ કહ્યું કે લોકોએ જોખમના સ્તરના આધારે વાયરસ સાથે જીવવાની નવી રીતો સાથે પોતાને અનુકૂળ બનાવવું પડશે. કોવિડ-૧૯ને કારણે કઈ અટકવું જોઈએ નહીં.

વેસ્ટર્ન રાઇઝસ એ દિવસના ઘટાડા બાદ બજારમાં ખેરદાર રિસ્કવરી સેન્સેક્સમાં ૧૭૩૬ અને નિફ્ટીમાં ૪૫૫ પોઈન્ટનો ઉલ્લેખનીય ઉછાળો

(એજન્સી) નવી દિલ્લી, ભારતીય શેરબજાર સોમવારે જેટલું ઘટ્યું હતું તેટલા જ પ્રમાણમાં મંગળવારે વધ્યું છે અને આ રીતે બંધો જ ઘટાડો સરભર કરી લીધો છે. રશિયા-યુક્રેન કટોકટીના કારણે ફૂડનો સલાહ્ય ખોરવાશે તેવા ભયથી સોમવારે બજાર ૧૭૪૭ પોઈન્ટ તુટ્યું હતું. પરંતુ મંગળવારે ઓઈલના ભાવની ચીંતા હળવી થતા જ બજારમાં ચીંતા ૧૭૩૬ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સના આ જબરજસ્ત ઉછાળા માટે રશિયાન સરકારની એક જાહેરાત જવાબદાર છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે યુક્રેન સાથે કરાર કરવાના સંકેત આપતા જ બજારનું સેન્ટીમેન્ટ સુધર્યું હતું. જિયોજિટ ફાઈનાન્શિયલ સર્વિસિસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે કહ્યું કે, યુક્રેન કટોકટીનો ડિપ્લોમેટિક ઉકેલ મળવો જોઈએ. બજારમાં સ્માર્ટ રિબાઈન્ડ આવશે. રશિયા યુક્રેન પર હુમલો કરશે તો યુએસની આગેવાની હેઠળ પશ્ચિમી દેશો

પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

(દિ. મી. એ), લખનો, યુપી વિધાનસભાની ચૂંટણી ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં સોમવારે જ બીજા તબક્કો પૂર્ણ થયો હતો. વિધાનસભાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી અશ્વિની કુમારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અશ્વિની કુમારે પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસ સાથેના દાયકાઓ જૂના સંબંધોનો અંત લાવ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસની બહાર રાષ્ટ્રીય હિતની વધુ સારી સેવા કરી શકે છે. આપને જણાવી દઈએ કે અશ્વિની કુમારની બે પેઢીઓ કોંગ્રેસ સાથે જોડાયેલી છે. રાજીનામાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે પાર્ટીમાં નેતૃત્વનો અભાવ છે. અશ્વિની કુમારે કહ્યું કે કોંગ્રેસ પોતાની જાતને ફરીથી સ્થાપિત કરવામાં અસમર્થ રહી છે અને સતત મેઠાન

SHIVANSH FINSERVE LIMITED

Regd. & Corporate Office- 22 First Floor, Harsidhp Complex, Opp Kalpur Commercial Bank , Income Tax, Ashram Road, Ahmedabad - 380009. Contact No - 7927540337, Email on - shivanshfinserve@gmail.com, website - www.shivanshfinserve.com

ANNEXURE I EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2021

PARTICULARS	Quarter ending (31/12/2021)	Quarter ending (30/09/2021)	Quarter ending (31/12/2020)	Nine Months ended Figures (31/12/2021)	Year to date Figures (31/03/2021)
1 Income from operations	4.26	128.96	16.77	133.22	256.43
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	(6.93)	31.03	(9.91)	19.02	11.07
3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	(6.93)	31.03	(9.91)	19.02	11.07
4 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	(5.19)	24.40	(9.73)	11.80	7.98
5 Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(5.19)	24.40	(9.73)	11.80	7.98
6 Equity Share Capital	624.00	624.00	624.00	624.00	624.00
7 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	17.62
8 Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -	(0.08)	0.39	(0.16)	0.19	0.13
Basic Diluted	(0.08)	0.39	(0.16)	0.19	0.13

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Bombay Stock Exchange and the listed entity www.shivanshfinserve.com. 2. The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote. 3.# - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.

Place : Ahmedabad For and on behalf of Board of Directors SHIVANSH FINSERVE LIMITED Sd/- JIGNESH SUDHIRBHAI SHAH "DIRECTOR" DIN: 02112343

PURPLE ENTERTAINMENT LIMITED

Regd. Office:- 30-B, 3rd floor, Ajanta complex, Income Tax, Ashram Road, Ahmedabad - 380009. Email on :- purpleentertainment7@gmail.com website :- www.purpleentertainment.co.in

ANNEXURE I EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2021

PARTICULARS	Quarter ending (31/12/2021)	Quarter ending (30/09/2021)	Quarter ending (30/12/2020)	Nine months ended Figures (31/12/2021)	Year to date Figures (31/03/2021)
1 Income from operations	-	-	-	-	-
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	18.66	7.85	16.94	36.41	33.25
3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	18.66	7.85	16.94	36.41	33.25
4 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	13.43	6.76	17.06	27.56	24.66
5 Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	13.42	9.27	17.06	30.06	24.66
6 Equity Share Capital	864.60	864.60	864.60	864.60	864.60
7 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	22.21
8 Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -	0.16	0.08	0.20	0.32	0.29
Basic Diluted	0.16	0.08	0.20	0.32	0.29

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Bombay Stock Exchange and the listed entity www.purpleentertainment.co.in 2. The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote. 3.# - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.

Place : Ahmedabad For and on behalf of Board of Directors Purple Entertainment Limited Sd/- MANJULABEN KOTHARI DIRECTOR DIN: 08012476

TIRUPATI SARJAN LTD.

Registered Office: A/11, 12, 13, Satyamev Complex, Opposite Gujarat High court, S.G. Highway, Ahmedabad 380060 M : 9179-2766 2013. Web: http://www.tirupatisarjan.com Email ID: cs.tirupatisarjan@gmail.com

Statement of Standalone Unaudited Financial Results for the third quarter and nine months ended 31st December, 2021 (in lacs)

SR. NO.	PARTICULARS	Quarter ended 31/12/2021	Nine Month Ended 31/12/2021	Quarter ended 31/12/2020
1	Total Income from Operations	2047.40	5629.01	1387.31
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	37.27	75.90	41.29
3	Net Profit / (Loss) for the period before tax (after Extraordinary and Extraordinary items)	37.27	75.90	41.29
4	Net Profit / (Loss) for the period after tax (after Extraordinary and Extraordinary Items#)	37.27	54.19	29.48
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	37.27	54.19	29.48
6	Equity Share Capital (FV Rs. 5/ each)	1649.91	1649.91	1649.91
7	Other equity	-	-	-
8	Earning per share (Face value Rs. 5/- each) (for continuing and discontinued operations)	-	-	-
	(a) Basic	0.11	0.16	0.09
	(b) Diluted	0.18	0.38	0.14

Notes: a) The above is an extract of the detailed format of quarterly/nine months Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly/nine months Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. b) The above results were approved by Audit Committee in its meeting held on 14th February, 2022 and subsequently taken on record by the Board of Directors at its meeting held on 14th February, 2022.

Date : 14/02/2022 For, Tirupati Sarjan Limited Sd/- Ruchir Rushikeshbhai Patel Director DIN : 03185133

ચીનમાં હરાજી સમયે કબૂતર ૧૪ કરોડ રૂપિયામાં વેચાયાં

(એજન્સી) નવી દિલ્લી, નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઊન સિવાય એક કબૂતર જેનું નામ પણ સંયોગથી કિમ છે, તે ચર્ચામાં છે. ચર્ચામાં આવવાનું કારણ કે કિમ વિશ્વનું સૌથી મોંઘુ કબૂતર બની ચુક્યું છે. ઘણા લોકોને આ એક મજાક લાગી શકે છે પરંતુ તે સત્ય છે. મહત્વનું છે કે કિમેલ કબૂતર ૧૪ કરોડમાં વેચાયું છે. આ કબૂતરને ચીનના એક વ્યક્તિએ હરાજીમાં સૌથી વધુ બોલી લગાવી હતી હતી. આ કબૂતર એક નિવૃત્ત રસિગ માદા કબૂતર છે. આ કબૂતરનું નામ કિમ છે અને

તે બે વર્ષનું છે, જે દુનિયાનું સૌથી મોંઘુ કબૂતર બની ચુક્યું છે. આ શાનદાર રેસર ૨૦૧૮માં ઘણી સ્પર્ધામાં વિજેતા રહી ચુક્યું છે. નેશનલ મિડલ ડિસ્ટેન્સ રેસની વિજેતા માદા કબૂતરની ગતિ જોરદાર છે. મહત્વનું છે કે ઘણા કોર્ટ નર કબૂતરો માટે ઉંચી બોલી લગાવે છે પરંતુ માદા કબૂતરની આટલી મોટી કિંમત ખરે ખર ચોકાવનારી છે. ચીનમાં કબૂતરોની રેસ એક ટ્રેન્ડ બની રહ્યાં છે. મહત્વનું છે કે માદા રેસિંગ કબૂતરોનો સારા રેસર કબૂતર પેદા કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

**કીમાન્ડ નોટીસ**  
વિશ્વવિદ્યાલયોના એન કોર્પોરેશન ઓફ ફાઇનાન્સિયલ એન્ડ એન્ડેમિક સિસ્ટમ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ૨૦૦૨ ની કંપન ૧૩ (૩) ડેવલ (ના કાયદો) વિશ્વવિદ્યાલય ઈન્ડિયા (એન્ડેમિક) ટ્રસ્ટ, ૨૦૦૨ ના નિયમ (ના નિયમો) ૩(૧) અને સંબંધિત આયોજનો હેઠળ ઉપરોક્ત અધિનિયમની કલમ ૧૩(૧) હેઠળ આયોજનમાં આવેલ સત્તાઓના ઉપયોગમાં આ નિયમોના નિયમ ૩ ની સાથે સંબંધિત, અર્થઘટન અને અન્ય કાયદા અધિનિયમો (IFIL HFL) (અર્થઘટન ઉપરોક્ત હેઠળ) હેઠળ ઉપરોક્ત અધિકારીને જારી કર્યું છે. ઉપરોક્ત અધિનિયમની કલમ ૧૩(૨) હેઠળ આયોજન, ઉપર લેવારા (ઓ) ને, તેઓને સંબંધિત કિમાન્ડ નોટિસ (ઓ)માં જણાવેલ રકમ પરત કરવા માટે હાલક કરે છે. ઉપરના સંબંધિત, ફરીથી આ સૂચન પ્રકાશિત થવાની તારીખથી ૬૦ દિવસની અંતર લેવામાં (ઓ)ને પુસ્તકી કરવા માટે સૂચન આપવામાં આવે છે, ના વધુ અર્થ સાથે, નોંધે જણાવેલ રકમ, ઓ માંથી સૂચન કુલવેલીની તારીખ સુધી લેવામાં (ઓ) નો વિવન, તારીખ મુજબની રકમ માંની સૂચના અને બોની રકમની સુકલવેલી માટે આપવામાં આવતી સૂચના નોંધે મુજબ છે.

દેવાદારો/ જમીનદારોના નામો  
શ્રી. સંદેશ્વર અમીયા, શ્રીમતી. નમનાબેન અર. કુર્બી (સુધિયા યોદ બાબ હમુ હજારે એસો. પ્રોપાઈટર ઈ કમ)  
શ્રી. દિનેશ રમેશભાઈ પુરી, શ્રીમતી. રમણબેન અર. પુરી (સુધિયા યોદ બાબ હમુ હજારે એસો. પ્રોપાઈટર ઈ કમ)  
શ્રી. દિનેશ રમેશભાઈ પુરી, શ્રીમતી. રમણબેન અર. પુરી (સુધિયા યોદ બાબ હમુ હજારે એસો. પ્રોપાઈટર ઈ કમ)

કેન્ડે નં. એન્. ૧૦૯, પહેલો માળ, અરીયા અફેર ૧૩ ૩ રેડ. ફોર્ટ, શ્રીકૃષ્ણ રાજ સુપર સેન્ટ્રલ, અવે. નં. ૩૦૯, મહેલપા, ગુરુદાસ ખાતે આવેલ વિશ્વકાન બંધ બાંધે સહિત  
ઈ/૩૦૯, આફર ૧૫ સ્ટે. યાર્ડ, વૃંદાવન ફોર્ટ, સેવેશ્વર, અમદાવાદ-૩૮૦૦૧૬, ગુરુદાસ ખાતે આવેલ વિશ્વકાન બંધ બાંધે સહિત

જો આ દેવાદાર ઉપરોક્ત IFIL, HFL ને સૂચવતી કરવામાં નિષ્ફળ જાય તો IFIL, HFL આ એક્ટની કલમ ૧૩(૨) હેઠળ ઉપરોક્ત કિમાન્ડ એન્ડેમિક સાથે કબાલીથી લાયક પરશે અને લાયક થતા નિયમોનુસારણે તે દેવાદારના જોખમ અને ભોને રહેશે. વધુ માહિતી માટે અધિકૃત અધિકારીશ્રીઓ: હાલક એસો. IFIL, HFL અમદાવાદ હાલક એસો. ચોપા માળ, કોમ્પ્લેક્સ હાઉસ-૨, શેલ પેટ્રોલ પંપની પાસે, આનંદનગર રોડ, પ્રહલાદનગર, અમદાવાદ-૩૮૦૦૫૧ અને સફલ કોમ્પ્લેક્સ, મહેલપા-૩૮૦૦૨૧/ અથવા કોમ્પોઝિટ ઓફિસ : આઈઆઈએફએલ ટાવર પ્લોટ નં.૯૮, ઉદ્યાન વિહાર, ફેસ-૨, ગુરુદાસ, હરીજીપ્લા સેક્ટર કરવો.

સ્થાન: અમદાવાદ અને મહેલપા તારીખ : ૧૬.૦૨.૨૦૨૨ સહી/ અધિવૃત્ત અધિકારી, IFIL, હોમ ડાયરેક્ટરની લીમીટેડ વતી

ROBERT RESOURCES LIMITED

CIN : - L99999GJ1982PLC096012  
REGD. OFF: - 3rd FLOOR, PLOT NO 1067, OPP. BINDU NIVAS, KALIYABD ROAD BHAVNAGAR-364001, GUJARAT, Contact No: +91-9067584982  
Email :- robertresourceslimited@gmail.com Website:- www.robertresources.com

Extract of Unaudited Financial Results for the Quarter and Nine month ended on December 31, 2021 (Rs. in Lakhs)

S. No.	Particular	Quarter ended (Unaudited) 31-12-2021	Quarter ended (Unaudited) 30-09-2021	Quarter ended (Unaudited) 31-12-2020	Quarter ended (Unaudited) 31-12-2020	Year Ended (Audited) 31-03-2021
1.	Total Income from operations (net)	228.22	43.00	17.63	271.49	67.51
2.	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary	200.73	100.62	15.08	215.79	23.27
3.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary	200.73	100.62	15.08	215.79	23.27
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	140.78	98.36	11.28	147.18	17.41
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income(after tax)]	101.86	99.83	27.37	172.42	60.21
6.	Equity Share Capital	1024.50	1024.50	1024.50	1024.50	1024.50
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	221.71
8.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -	1.37	0.96	0.11	1.44	0.17
	1. Basic:	1.37	0.96	0.11	1.44	0.17
	2. Diluted:	1.37	0.96	0.11	1.44	0.17

Notes: 1. The aforsaid results of the Company were reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 14th February, 2022. The statutory auditors of the Company have carried out a Limited Review of the aforsaid results. 2. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange www.mse.in and on company's website www.robertresources.com. 3. The Previous year/period figures have been regrouped/rearranged, wherever necessary to make them comparable with the current period figures.

Place : Bhavnagar. For, Robert Resources Limited Sd/- Hanif Shekh Managing Director DIN : 07497812

KANUNGO FINANCIERS LIMITED

CIN: - L65100GJ1982PLC086450  
REGD. OFFICE: - B-7, B wing, 5th Floor Ajanta Commercial Center, Income Tax, Ahmedabad - 380009, (07) 9-48002688, Mail at: - kanungofinanciers@gmail.com, website:- www.kanungofinanciers.com

ANNEXURE I EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2021

PARTICULARS	Quarter ending (31/12/2021)	Quarter ending (30/09/2021)	Quarter ending (31/12/2020)	Nine Months ended Figures (31/12/2021)	Year to date Figures (31/03/2021)
1 Income from operations	-	-	-	-	-
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	(8.79)	(154.22)	113.42	(354.26)	(14.44)
3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	(8.79)	(154.22)	113.42	(354.26)	(14.44)
4 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	(3.81)	(155.87)	109.17	(354.78)	(29.67)
5 Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	52.68	147.99	162.15	29.18	52.20
6 Equity Share Capital	463.40	463.40	463.40	463.40	463.40
7 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	35.54
8 Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -	(0.08)	(3.36)	2.36	(7.66)	(0.64)
Basic Diluted	(0.08)	(3.36)	2.36	(7.66)	(0.64)

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Bombay Stock Exchange and the listed entity www.kanungofinanciers.com. 2. The impact on net profit / loss, total